



BHARUCH ANKLESHWAR URBAN DEVELOPMENT AUTHORITY

Old Collector Office, Kanbivaga, Bharuch

Ph. No.- (02642) 222075/222073

Email:ceo.bauda@gmail.com



**Name of Work : Providing, Installing and testing of Street Light From
Zadeshwar Chawkdi to Tavra Village on Bharuch
– Shukaltirth Road Bharuch. (3rd Attempt)**

TENDER DOCUMENTS

**CHIEF EXECUTIVE AUTHORITY
BHARUCH ANKLESHWAR URBAN DEVELOPMENT AUTHORITY
OLD COLLECTOR OFFICE
KANBIVAGA
BHARUCH Ph : (02642)
222075 / 222073**

Name of Work: - Bid Documents for Providing, Installing and testing of Street Light From Zadeshwar Chawkdi to Tavra Village on Bharuch – Shukaltirth Road Bharuch (3rd Attempt)

Index

Sr. No.	Particulars	Pages from to
1	Memorandum of work in brief	03-04
2	Tender Notice	05-06
3	Qualification Criteria	07
4	Special Conditions	08-23
5	Instruction for online tender to Bidders	24
6	Contractors to please read this carefully	25-26
7	Volume - I – Technical Bid	27-57

MEMORANDUM OF WORK IN BRIEF

1)	Name of work	Bid Documents for Providing, Installing and testing of Street Light From Zadeshwar Chawkd to Tavra Village on Bharuch – Shukaltirth Road Bharuch (3rd Attempt)
2)	Estimated cost	Rs. 82,77,628.00
3)	Tender Fees	Rs.2400=00
4)	Earnest Money	83,000=00 (Eighty Three Thousand Rupees only) in the form of DD/FDR from nationalized Bank or scheduled Bank only in favor of “CEA BAUDA BHARUCH
5)	Validity period of tender offer	120 days from the date of opening of the Tender
6)	Security Deposit (Total 5%) (i) Initial Security Deposit equivalent to 10.00% of the estimated cost put to tender shall be in the form of DD/FDR of Nationalized Banks / UTI, ICICI, HDFC, IDBI banks & NSC or SSNNL bonds etc.	Rs. 4,15,000.00 (5.00%)- Deposit Rs. 4,15,000.00 (5.00%)- From Bill
7)	Defect liability period (Free Maintenance)	36 Months from the date of completion of work. with all material and Workmanship.
8)	Time limit for completion of work from the date of written order to commence.	03 (Three) Months
9)	Mode of sending the tender. (e-tendering)	Uploading from 18.06.2026 to 29.06.2026 up to 18.00 hrs. on www. nprocure.com
10)	1) Date of Submission/verification of Tender fee, EMD & other Documents 2) Opening of the Tenders	06.07.2026 up to 18.00 hrs OLD COLLECTOR OFFICE KANBIVAGA BHARUCH Ph : (02642) 222075 / 222073 07.07.2026 @ 12.00 Hrs.
11)	Eligibility	“D” Class & Above , (and Contractor having similar type of work experience)

Signature of contractor,

12)	Mode of quoting the rate in Schedule "B" attached.	In figures as well as in words. Any mis-outs, discrepancies in may attract rejection of tender.
13)	Testing charges.	All testing of material /out put of processed material shall have to be got tested in a govt. recognized / Govt approved laboratory, as defined in general / technical specification / Item wise specification. The payment for the testing charges to the laboratory shall be made by of BAUDA. Authority as per bill received. The contractor shall pay an amount equal to 1% of estimated cost of executed work as testing charges. Such testing charges shall be recovered from each running account bill to the extent of 1%.However,recovery of total charges shall be limited to 1% of estimated cost put to tender only. (vide Govt. of Gujarat Ver. Resolution No.TNC/1085/(4) Dated 10-5-1985 & TNC/1085/4-C/ Dated 20-12-1993.

QUALIFICATION CRITERIA

The applicants will be qualified and short listed based on their merits and bid evaluation criteria mentioned herein as per **Road and Building Government of Gujarat Resolution No. RGN-6089-8-Part-1-C-14, Sardar Bhavan, Sachivalay, Gandhinagar Dated 06-08-2011**. The price bid of only those contractors will be opened who satisfies the following criteria.

1. The contractor should be **registered in Category “D”** or above with the Govt. of Gujarat / R&B Electrical / Central Govt.
2. (a) Applicant/ contractor must have Three similar completed works, each costing not less than the amount equal to **40%** of estimated cost put to tenders,.

(b) Two similar completed works, each costing not less than the amount equal to 50% of estimated cost put to tender

(C) One similar completed work of aggregate cost not less than the amount equal to 80% of estimated cost put to tender.

Note : (I) Only projects of Govt./Semi govt./ Nagarpalika Shall be considered for evaluation.

(ii) Similar type of work means SITC Work for Street Light

(ii) Certified copy of completion certificate showing contract values in 3A Form must be submitted.(Only work order will not be accepted)

3. The annual average turnover of the applicant must be **Rs. 15.00 Lacs** or more during last **THREE(03) financial years**. (The C.A. Certificate should be submitted in support of the same.)
4. The Bidders are required to submit Bank Solvency certificate of Current year of **any Nationalize bank of 20% amount of Tender cost** or more current year.
5. Attested copy of EPF Registration certificate to be submitted
6. Attested copy of PAN CARD and GST Certificate are to be submitted.
7. I.T. Return of last 3 financial year
8. The contractor should also submit documentary evidences proving his credentials, Experience, Technical & Financial Personnel, Manpower and Material, Machinery resources related to SITC Work for Street Light work Bidders should also give list of sites where the works done by him can be inspected for assessment of quality of workmanship. The bidder shall submit Chartered Account's certificate in support of the financial criteria.
9. The bidder must submit organization chart showing the strength of technical & qualified manpower.
10. GST Shall be paid extra at the prevailing rate while payment.
11. **Joint Venture is not Allowed.**
12. **BAUDA reserve the right to reject any or all tenders with any reason thereof.**

Special Note : -

1. Unworkable or un reasonable rate quoted by agency shall not be entertained and likely to be rejected (Misleading justification of quoted rates shall not be accepted and may lead to rejection of offer)

Special Conditions

ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી

કામની ખાસ શરતો

1. BAUDA દ્વારા આપેલ વર્કઓર્ડરની કામગીરી ઇજારદારીએ સદર મંજૂર થયેલ ભાવથી જ કરવાની રહેશે. જેમાં ભાવ વધારો કે અન્ય માંગણી ગ્રાહ્ય રાખી શકાશે નહિ.
2. BAUDA દ્વારા જે કામો કરવાની સુચના કે વર્ક ઓર્ડર આપેથી અને જે કામની આઈટમનો સદરહુ ભાવપત્રકમાં મંજૂર થયેલ હશે તેવા તમામ કામો કરવાના રહેશે. સદર કામની સમય મર્યાદા કામની અગત્યતા તથા કામનાં પ્રકારને ધ્યાને લઈ ફેરફાર થવા પાત્ર છે.
3. ઇલેક્ટ્રીકલ વર્કની કામગીરી R & B માન્ય ઇજારદાર પાસે કરાવવાની રહેશે.
4. પેમેન્ટ ચુકવણું :- ઇજારદારશ્રી દ્વારા કરેલ કામનાં બીલ BAUDANAં સ્વભંડોળ/ગ્રાન્ટ ભંડોળને ધ્યાનમાં રાખી કરવામાં આવશે.
5. BAUDANAં કોઈપણ કામ માટે ફક્ત સપ્લાય કરવાની થતી આઈટમનાં જરૂરી સરકારશ્રીનાં પ્રમાણિત આધાર સાથે સપ્લાય કરવાની રહેશે. જેનો લોડીંગ તથા અનલોડીંગનાં ચાર્જ અલગથી ચુકવવામાં આવશે નહીં.
6. ચુકવવાનાં થતા બીલોમાંથી :-
 - બીલ ની રકમનાં ૫.૦% SD કપાત કરવાની રહેશે.
 - બીલ ની રકમમાંથી સરકારી નિયમાનુસાર ઇન્કમ ટેક્સ કપાત કરવાની રહેશે.
 - બીલની રકમનાં ૧.૦૦% લેખે લેબર વેલ્ફેર શેષ કપાત કરવાની રહેશે.
7. સાઈટ એન્જીનીયર :-

એજન્સી દ્વારા કામ સંપૂર્ણ રીતે પુરુ થાય ત્યાં સુધી કક્વોલીટીફાઈડ અનુભવી સાઈટ એન્જીનીયરો દરેક સાઈટ પર મુકવાના રહેશે. જો નહીં મુકવામાં આવે તો કોન્ટ્રાક્ટરના બીલમાંથી માસિક રૂા.૪૦,૦૦૦/- ની કપાત કરવામાં આવશે.
8. કન્સલ્ટન્ટ દ્વારા : સુપર વીઝન

સદર કામનું રોજ રોજનું સુપરવીઝન- મોનીટરીંગ તથા ક્વોલીટી કંટ્રોલ કરવાનું કામ અનુભવી નિયુક્ત કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવશે આમ કામનો પ્રોગ્રેસ તથા ક્વોલીટી જાળવવા માટે એજન્સીએ પુરતો સહકાર આપવાનો રહેશે.
9. PMC એજન્સી દ્વારા ક્વોલીટી ચેકીંગ તથા ક્વોલીટીની ખાતરી.

સદર કામોનું રોજે રોજનું ક્વોલીટીનું ચેકીંગ તથા જરૂરી માલ-સામાનનું ફિલ્ડ પર તથા લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરવા માટે PMC એજન્સીની નિમણૂક કરવામાં આવશે. કામોની ગુણવત્તા જાળવવા કોન્ટ્રાક્ટરે ટી.પી.આઈને સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે.

10. ટેસ્ટીંગની ક્ષમતા : ક્વોલીટી કન્ટ્રોલ અને મટીરીયલ ટેસ્ટીંગ નિયત કરેલા નિયમો મુજબ ગવર્નમેન્ટ રજીસ્ટર્ડ લેબમાંથી કોન્ટ્રાક્ટરે કરાવવાના રહેશે.

11. કામની ગેરેટી (૩ વર્ષ) ટેન્ડરમાં દર્શાવેલ દરેક આઈટમોનું કામ પુર્ણ કર્યા અને કંપલીશન સર્ટીફિકેટ મેળવ્યા પછી ત્રણ વર્ષ સુધી રોડ તથા અન્ય કામોની જાળવણી કરવાની રહેશે. આ સમયગાળા દરમિયાન દરેક પ્રકારનું મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટરે સ્વખર્ચે કરવાનું રહેશે. આ જાળવણી પછી ૩ વર્ષ ના સમયગાળા પછી જ ડીપોઝીટ છુટી કરવામાં આવશે. તથા સદર કામગીરી દરમિયાન લીડ અને લીફટ, તમામ આનુસંગિક સાધનો સહિત મરામત અને નિભાવણીની કામગીરી કરવાની રહેશે.

કોન્ટ્રાક્ટરની સહી

(નામ)

કોન્ટ્રાક્ટરે આ શરતો ખાસ વાંચવી અને નોંધ લેવી

ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી

::ટેન્ડર ઓફરની જનરલ શરતો::

1. આ ટેન્ડર પર્સન જે રેઈટ બેઈઝ પર માંગવામાં આવેલ છે. કોન્ટ્રાક્ટરે પોતાના ભાવ આંકડામાં તેમજ શબ્દોમાં ભરી કુલ સરવાળો કરવાનો રહેશે.
2. દરેક આઈટમના અંદાજીત જથ્થામાં ગમે તેટલો વધારો કે ઘટાડો થઈ શકશે અને કોઈ આઈટમ સંપૂર્ણપણે રદ થઈ શકશે કે નવી આઈટમ ઉમેરી શકાશે, આમ છતાં આવી આઈટમ કે આઈટમના જથ્થાના ફેરફારથી ટેન્ડરમાં બતાવેલ આઈટમના ભાવમાં કોઈપણ જાતનો ફેરફાર થશે નહીં. કોન્ટ્રાક્ટરને દરેક લાગુ પડતી આઈટમની ચુકવવા પાત્ર થતી રકમ કોન્ટ્રાક્ટ મુજબ સાઈટ પર દેખરેખ થયેલ કામના માપ પરથી ચુકવવામાં આવશે. ટેન્ડરમાં બતાવેલ આઈટમ રેઈટના બધા જ માલસામાન તથા મજૂરીના ખર્ચનો સમાવેશ થઈ જાય છે અને તે બાબતે કોઈપણ જાતની વધારાની રકમ ચુકવવામાં આવશે નહીં. નવી ઉમેરેલી આઈટમના ભાવ ટેન્ડરમાં તે પ્રકારની આઈટમના ભાવ ઉપરથી અથવા તો રેઈટ એનાલીસીસ બનાવીને તે ઉપરથી અથવા તો ચાલુ બજારના ભાવો ઉપરથી BAUDA નક્કી કરે તે મુજબ કરાવવાના રહેશે.
3. શેડયુલમાંની કોઈપણ આઈટમના વર્ણન કે જથ્થામાં થયેલી ભુલ કે ક્ષતિ ના કારણે આ કોન્ટ્રાક્ટનો ભંગ થયો ગણાશે નહીં પરંતુ તેને ફેરફાર તરીકે ગણવામાં આવશે.
4. આ ટેન્ડર ઓફરની સાથે ટેન્ડરના તથા CEA ના સંયુક્ત નામોની ફિક્સ ડિપોઝીટ રસીદ કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકની અર્નેસ્ટમની ડિપોઝીટ પેટે જોડવાની રહેશે. કામ મંજૂર થયેથી ૫.૦૦ % મુજબ સિક્યોરીટી ડિપોઝીટ એફ.ડી.આર/ડી.ડી સ્વરૂપે ભરવાની રહેશે.
5. આ ટેન્ડર ઓફરની કાયદેસરતા આ ટેન્ડર ખુલ્લા પછીથી ૧૨૦ દિવસ સુધીની રહેશે.
6. ટેન્ડર ઓફર ભરતા પહેલા કામના સ્થળની પુરી તપાસ કરીને જમીનના લેવલ જમીનના પ્રકાર ઇલેક્ટ્રીક પાવર અને પાણી વ્યવસ્થા વિગેરેની સંપૂર્ણ જાણકારી મેળવેલ છે તેમ માનવામાં આવશે. સાઈટકન્ડીશનને કારણે ઉદભવેલા કોઈપણ દાવાને ધ્યાનમાં લેવામાં નહીં આવે અને કામ માટે તેની વ્યવસ્થા કોન્ટ્રાક્ટરે પોતે કરવાની રહેશે.
7. અધુરી અથવા અસ્પષ્ટ ઓફરને ગેરલાયક ઠરાવી શકાશે.
8. કોઈપણ કારણ દર્શાવ્યા વિના કોઈપણ એક કે બધી જ ટેન્ડર ઓફરો રદ કરવાનો કે સ્વીકારવાનો હક્ક અમોને અભાધીત રાખેલ છે.
9. પાણી તથા તેને માટે જોઈતી પાઈપ લાઈન તેમજ ઇલેક્ટ્રીકની તમામ વ્યવસ્થા કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે કરવાની રહેશે.
10. ચાલુ કામે હયાત પાણીની લાઈન, ગટર લાઈન કે કેબલોને કે કોઈ સર્વિસ લાઈનને નુકશાન થશે તે કોન્ટ્રાક્ટરે સ્વખર્ચે તાત્કાલીક રીપેર કરવાના રહેશે.
11. કામ અંગેના તમામ હક્ક અધિકાર BAUDAને અબાધિત રહેશે.

કોન્ટ્રાક્ટરની સહી

(નામ.....)

ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી

:::: કોન્ટ્રાક્ટની શરતો :::

(૧) સમય મર્યાદા:

અગાઉ જણાવેલ સમય મર્યાદા વર્ક ઓર્ડર આપ્યાની તારીખથી અમલમાં આવી ગયેલ ગણાશે સમય મર્યાદાએ આ કોન્ટ્રાક્ટની અગત્યની શરત ગણાશે એટલે કોન્ટ્રાક્ટરે આ કામ ઉપરોક્ત સમય મર્યાદામાં કે તેથી વહેલુ પુરુ થાય તેવા શક્ય તમામ પ્રયાસો કરવા જરૂરી છે.

(૨) સ્પેશીફિકેશન :

કોન્ટ્રાક્ટરે દરેક કામ સંપૂર્ણપણે સ્પેસીફિકેશન પ્રમાણે જ કરવાના રહેશે BAUDA વતી કન્સલ્ટીંગ એન્જીન્યરે આપેલ ડિઝાઇન, ડ્રોઇંગ, સ્પેસીફિકેશન કે સુચનાઓ લેખિત સ્વીકારીને આવું કામ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે બધી જ વખતે પી.ડબલ્યુ.ડી. હેન્ડ બુક વોલ્યુમ : ૧ અને ૨ અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટીટ્યુટ દ્વારા આપેલ સ્ટાન્ડર્ડ સ્પેસીફિકેશન તથા ઇલેક્ટ્રીક વિભાગના સ્પેશીફિકેશનનો અમલ કરવાનો રહેશે.

(૩) આખરી નિર્ણય :

સ્પેસીફિકેશન, ડ્રોઇંગ, માપસાઇઝ કામની ગુણવત્તા આઇટેમ રેઇટ, બીલ, કોન્ટ્રાક્ટની શરતો, કામનો જથ્થો, કામનો પ્રોગ્રેસ, સમય મર્યાદા, ટેન્ડર શરતોના અર્થ, સ્પષ્ટીકરણ અને મુલ્યાંકન વિગેરે તમામ ટેકનીકલ બાબતો માટે BAUDA વતીથી નિર્ણય આખરી અને બન્ને પાર્ટીઓને બંધનકર્તા રહેશે.

(૪) પેમેન્ટની શરતો :

(અ) સિક્યોરીટી ડિપોઝીટ એજન્સીએ ભાવ મંજૂર થયાથી ૫.૦૦% મુજબ એક ડીઆર, સ્વરૂપે ભરવાની રહેશે તેમજ બિલમાંથી ૫.૦૦% મુજબ કપાત કરવામાં આવશે. આમ કુલ ૧૦.૦% મુજબની સિક્યોરીટી ડિપોઝીટને પ્રોજેક્ટ પુર્ણ થયા બાદ કમ્પલીશન સર્ટીફિકેટ મળ્યે ૩- વર્ષ ડી.એલ.પી પુર્ણ થયા બાદ ૬.૦ રીલીઝ કરવામાં આવશે.

(બ) દરેક રનીંગ બિલ પુરી થયેલ ટેન્ડર આઇટેમના ભાવ પ્રમાણે ૧૦૦% રકમની ચુકવણી કરવામાં આવશે. તેમજ દરેક રનીંગ/ફાઇનલ બિલમાંથી અગાઉ ચુકવેલ પેમેન્ટ બાદ કરવામાં આવશે. તેમજ દરેક રનીંગ/ફાઇનલ બિલમાંથી ૫.૦૦% મુજબ રીટેન્શન મની કપાત કરવામાં આવશે. જે રકમ સંપુર્ણ કામ પુર્ણ થાય અને ફાઇનલ બિલના પેમેન્ટ થયા બાદ કમ્પલીશન સર્ટીફિકે ડી.એલ.પી પુર્ણ થયા બાદ રીલીઝ કરવામાં આવશે.

(ક) કોન્ટ્રાક્ટરના દરેક રનીંગ/ફાઇનલ બિલ તથા કામ પેટેના ચુકવણામાંથી સરકારશ્રીના ધારાધોરણ મુજબ ઇન્કમેટેક્સ BAUDA દ્વારા કપાત કરી સરકારશ્રીના નિયત હેડે ભરી દેવામાં આવશે. તેમજ ૧% વેલ્ફેર લેબર ફંડ કપાત કરવામાં આવશે.

(ડ) મંજૂર થયેલા ભાવો ઉપર કોઇપણ સંજોગોમાં ભાવવધારો (પ્રાઇઝ એક્સકેલેશન) આપવામાં આવશે.

ઈ) કોન્ટ્રાક્ટર દર કેલેન્ડર માસમાં વર્ક પ્રોગ્રેસનું દરેકનું એક અથવા બે- બીલ રજુ કરી શકશે.

(૬) પેનલ્ટી :-

કોન્ટ્રાક્ટરને આપેલસમયમર્યાદામાં કોન્ટ્રાક્ટર જો સંતોષકારક રીતે કામ પુરુ ન કરી શકે તો કોન્ટ્રાક્ટર પાસેથી દૈનિક ૧% થી ૧૦% મુજબ જેટલા દિવસ મોડુ થયુ હશે તેટલા દિવસની પેનલ્ટી BAUDA ના નિર્ણય ઉપર વસુલ કરવામાં આવશે.

(૭) એક્સ્ટ્રા આઈટમો :-

(અ) એક્સ્ટ્રા આઈટમ કે એક્સ્ટ્રા કામો માટેના રેઈટ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તેમજ પી.ડબલ્યુ.ડી.ના ચાલુ એસ.ઓ.આર. મુજબ અથવા તે સમયના બજારભાવો તથા કોન્ટ્રાક્ટરે આપેલ રેઈટ એનાલીસીસ અને કોન્ટ્રાક્ટરમાં આવતી તે જાતની આઈટમના ભાવ ઉપરથી નક્કી કરવામાં આવશે. આવી એક્સ્ટ્રા આઈટમ એક્સ્ટ્રા કામોના BAUDA એ નક્કી કરેલા ભાવ આખરી અને બંને પાર્ટીને બંધનકર્તા રહેશે.

(૮) સલામતીની વ્યવસ્થા :-

કોન્ટ્રાક્ટરે કામ સંતોષકારક રીતે પુર્ણ થાય ત્યાં સુધી બધા માણસો માલસામાન અને પ્રોપર્ટીની સલામતી અને રક્ષક માટેની જરૂરી અને પુરતી વ્યવસ્થા અને ગોઠવણી કરવી પડશે. કોઈપણ કામ માટે BAUDA એ સોંપેલ માલની લેખિત પહોંચ આપી તેની જાળવણી અને વ્યવસ્થિત ઉપયોગ કરી વધેલ માલની પાછી સોંપણી કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. કામ દરમ્યાન ટ્રાફિક ડાયવર્ઝન, બેરીયર્સ તથા સેફ્ટી ટેપ મોકલવાની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે તથા આ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કામ કરવાની મંજૂરી મળશે નહીં.

(૯) વિમો :-

(અ) ચાલુ કામ દરમ્યાન અને કામ સંપૂર્ણ પુરુ થાય ત્યાં સુધી BAUDAએ સોંપેલ માલ અને BAUDAએ પેમેન્ટ કરેલ કોન્ટ્રાક્ટરના માલને કોઈપણ કારણોને લીધે થતા નુકશાન કે ઘટની જવાબદારી સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટરની રહેશે. આ કામ પુરુ થાય માટે ત્યાં સુધીના માલસામાન કામના જોખમે તથા આજુબાજુની માલમિલ્કતને થાય તેવા નુકશાન માટે BAUDA સુચવે તેવો વિમો કોન્ટ્રાક્ટરે લેવો પડશે. આવી વિગતની પોલીસી કોઈપણ નેશનલાઈઝડ વિમા કંપનીમાંથી BAUDA ની ફેવરમાં કુલ સમય મર્યાદા તથા ટાઈમ લીમીટનો વધારો કે કામ મોડુ પુરુ થાય ત્યાં સુધી સમયની લેવાની રહેશે તેનું તમામ પ્રિમિયમ કોન્ટ્રાક્ટરે ભોગવવાનું રહેશે.

(બ) આ ઉપરાંત કોન્ટ્રાક્ટર ચાલુ કામ દરમ્યાન કામ કરતા પોતાના માણસો તથા BAUDA ના કોઈપણ પ્રતિનિધીઓ માટે વર્કમેન કોમ્પનશનલ ઈન્સ્યોરન્સ કામ પુરુ થાય ત્યાં સુધીના સમય માટે લેવાનો રહેશે.

(૧૦) ચોકીદાર:-

કોન્ટ્રાક્ટરે પોતાના સ્વખર્ચે સાઈટ ઉપર તમામ માલ સામાનની સલામતી જાળવણી કરી શકે તેવા ચોકીદારની વ્યવસ્થા કરવાની રહેશે આવી વ્યવસ્થા માલ સામાન તેમજ મજૂરોની સલામતી તેમ માલસામાનની હેરફેર તથા સ્ટોરેજને કન્ટ્રોલ કરી શકે તેવી પુરતી રાખવાની રહેશે.

(૧૧) બ્રાન્ડ (મેઈક) :-

જ્યાં જ્યાં કોઈ કામ માટે BAUDAના એન્જીનીયર કોઈ મટીરીયલ્સ માટે કોઈ ચોક્કસ બ્રાન્ડ કે

મેઈક દર્શાવેલ હોય ત્યાં કોન્ટ્રાક્ટરે તેજ વસ્તુ વાપરવાની રહેશે. કોન્ટ્રાક્ટર આવી વસ્તુઓની સમકક્ષ બ્રાન્ડ કે મેઈક BAUDAના એન્જીનીયરની પૂર્વ મંજૂરી લીધા પછી વાપરી શકાશે. અને આવી પૂર્વ મંજૂરી આ ફેરફાર માટેના કોન્ટ્રાક્ટરે રજૂ કરેલા બધા કારણો લક્ષમાં રાખીને આપવામાં આવશે.

(૧૨) ઝાડ પાન :-

દર્શાવેલા ઝાડ કે વનસ્પતિને ચાલુ કામ દરમ્યાન નુકશાન ન થાય તે રીતે જાળવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. આવા ઝાડથી ત્રણ ફૂટ ત્રિજ્યાની અંદર જમીનનું લેવલ બદલાવી શકાશે નહીં જરૂર જણાય ત્યાં આવી જગ્યાએ કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે કામ ચલાઉ ફેન્સીંગની વ્યવસ્થા કરી આપવી પડશે.

(૧૩) નક્કી આઈટેમ રેઈટ :-

આ કોન્ટ્રાક્ટમાં આવતી તમામ આઈટેમોના નક્કી કરેલ અને બન્ને પાર્ટીઓએ સ્વિકારેલા ભાવે કામ પુરું થાય ત્યાં સુધી કાયમ રહેશે તેમજ ભાવ વધારો કે બીજા કોઈપણ કારણોસર કોઈપણ જાતનો ફેરફાર આ ભાવોમાં કરી શકાશે નહીં. બેઝીક રેઈટના ભાવફેર તથા એક્સ્ટ્રા આઈટેમ કે એક્સ્ટ્રા કામમાં BAUDA દ્વારા નક્કી કરાવેલ ભાવ ફાઈનલ ગણાશે.

(૧૪) પર્ટ-સી.પી.એમ. પ્લાનીંગ :-

કોન્ટ્રાક્ટરે વર્ક ઓર્ડર મળ્યાની ૧૫ દિવસની અંદર પર્ટ-સી.પી.એમ. ચાર્ટ તૈયાર કરીને કામ ચાલુ કરવાની તથા પુરું કરવાની સંભવિત તારીખો સાથે કામના જુદા જુદા સ્ટરોએ બધી એક્ટીવીટી માટે BAUDA ના કન્સલ્ટીંગ એન્જીનીયર પાસે મંજૂર કરેલ પ્રોગ્રામ મુજબ જ કામ કરવાનું રહેશે.

(૧૫) સાઈટ ચોખ્ખી રાખવા બાબત :-

સાઈટની જગ્યા તથા મજૂરોના રહેઠાણ તથા તેમની કામ કરવાની જગ્યા સારી સ્થિતિમાં રાખવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. સાઈટ પરની બધા અડચણો પથ્થરો તથા અન્ય મટીરીયલ કચરો કે ઘાસપાન વિગેરે કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે દૂર કરી સાઈટ ચોખ્ખી કરવાની રહેશે. કામ પુરું થયે સાઈટ પરના ખાડાઓ કે છૂટા પથ્થરો કાઢવાથી થયેલ ખાડાઓ મુરમથી પુરી બરોબર રોલીંગ કરી સાઈટ ચોખ્ખી કરાવવા માટે કોન્ટ્રાક્ટરને કોઈપણ જાતનું વધારાનું પેમેન્ટ કરવામાં નહીં આવે.

(૧૬) સાઈટ એન્જીનીયર :-

ચાલુ કામ દરમ્યાન કોન્ટ્રાક્ટ આખા દિવસના સમય માટે BAUDA મંજૂર કરે તેવો અનુભવી અને લાયકાત ધરાવતો એન્જીનીયર રાખવાનો રહેશે અને પ્રોજેક્ટ સાઈટ પર જ્યારે માણસો કામ કરતા હોય ત્યારે તેની પુરી હાજરી રાખવી પડશે. કોન્ટ્રાક્ટરે રાખેલ આવા એન્જીનીયરને BAUDA ના એન્જીનીયરે આપેલ કોઈપણ સુચના સમજૂતી દોરવણી કે નોટિસ એ કોન્ટ્રાક્ટરને આપ્યા બરાબર ગણાશે. જો એજન્સી દ્વારા એન્જીનીયર નહીં મુકવામાં આવે તો દરમાસે રૂ. ૪૦,૦૦૦/-ની બીલમાંથી કપાત કરવામાં આવશે.

(૧૭) માણસો છુટા કરવા :-

BAUDA ના કન્સલ્ટીંગ એન્જીનીયરની સુચનાથી કોન્ટ્રાક્ટરે પોતાના કામ ઉપર રાખેલ કોઈપણ માણસો કે જે તેમની દ્રષ્ટી એ ગેરલાયક કે ગેરવર્તણૂક કરતો અભ્યાસ લાગશે. તેને તુરંત રજા આપીને છુટો કરી દેવો પડશે. અને BAUDA ના એન્જીનીયરની લેખિત મંજૂરી વિના આવા છુટા કરેલ માણસને ફરીથી કામે રાખી શકશે નહિ.

(૧૮) વધારાનો માલસામાન :-

કામ સંપૂર્ણ રીતે પુરુ થયા પછી જ વધારાનો માલસામાન BAUDA ની મંજૂરી પછી કોન્ટ્રાક્ટરને સાઈટ પરથી લઈ જવા દેવામાં આવશે.

(૧૯) પેમેન્ટ હકો :-

કોન્ટ્રાક્ટરે સપ્લાય કરેલ માલ કે કોન્ટ્રાક્ટરે કોઈપણ કામને કારણે ઉભા થતા પેમેન્ટ હકો રોયલ્ટી, લાયસન્સ ફી, નુકશાન, ખર્ચ કે વળતરના દાવાઓની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની પોતાની રહેશે. આ કામ માટે વપરાશમાં આવતો માલસામાન સિમેન્ટ, કપચી, મેટલ, મોરમ, રેતી, લોખંડ, હાથફોડ મેટલ, ઈંટ, આર.સી.સી.એન.પી. ૨ ક્લાસ પાઈપ એસ્ક્રાલ્ટની રોયલ્ટી, ફી ,ઇલેક્ટ્રીના કામો તથા અન્ય તમામ જાતના સરકારી ટેક્ષ વિગેરે કોન્ટ્રાક્ટરે ભરવાના રહેશે.

(૨૦) સાઈટ મીટીંગ :-

કામની વ્યવસ્થીત પ્રોગ્રેસ કે કામ દરમ્યાન ઉભા થયેલ પ્રશ્નોની વિચારણા માટે અથવા તો કામના સંકલન માટે BAUDA ના કન્સલ્ટીંગ એન્જીનીયરે બોલાવેલ સમયે વખતો વખતની સાઈટ મીટીંગમાં હાજર રહેવું પડશે.

(૨૧) બાળ મજૂરો :-

કોન્ટ્રાક્ટરે ૧૮ વર્ષથી નીચેના બાળમજૂરોને કામ પર રાખવા નહી. જો સ્ત્રી મજૂરો, કામ ઉપર હોય તો કોન્ટ્રાક્ટરે નાના બાળકોના રક્ષણ માટે તથા કામના સ્થળથી તેમને દુર રાખવાની તમામ વ્યવસ્થા કરવાની રહેશે. BAUDA ને લેખિત મંજૂરી સિવાય કોન્ટ્રાક્ટરના માન્ય ચોકીદાર સિવાય બીજા કોઈપણ મજૂરો ને કમ્પાઉન્ડમાં રહેવા દેવામાં આવશે નહિ.

(૨૨) ઈન્સ્પેક્શન :-

કોન્ટ્રાક્ટમાં આવતું કોઈપણ જાતનું ચાલુકામ અથવા થઈ ગયેલું કામ કોઈપણ સમયે BAUDA ના કન્સલ્ટીંગ એન્જીનીયર/ટી.પી.આઈ. તપાસી શકશે તે રીતે ખુલ્લું રાખવું પડશે. આવી દરેક

વિઝીટ વખતે કોન્ટ્રાક્ટરે તપાસ થઈ શકે અને માપ સાઈઝ લઈ શકાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થા અને માણસોની મદદ કરવી પડશે.

(૨૩) અન્ય કોન્ટ્રાક્ટરો :-

આ કોન્ટ્રાક્ટરોનું કોઈપણ કામ આપવું અથવા તો તેનો કોઈ ભાગ અથવા તો બીજું કામ કે બીજી આઈટમનું કામ કરવા માટે અન્ય કોન્ટ્રાક્ટર રાખવાનો BAUDA નો અબ્યાધિત હક રહેશે. કોન્ટ્રાક્ટરે આવા બીજા કોન્ટ્રાક્ટરને કામ શરૂ કરવાથી પુરુ કરવા સુધી. સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે.

(૨૪) ક્ષતિવાળા કામોનો નિકાલ :-

જો BAUDA ના કન્સલ્ટીંગ એન્જીનીયર - ટી.પી.આઈ ને કોઈ કામ અથવા તેનો ભાગ સ્પેશીફિકેશન મુજબના મટીરીયલ્સ થી ન થયેલો અથવા અયોગ્ય કારીગરીવાળો જણાશે તો સમયે સમયે લેખિત હુકમ આપીને હુકમમાં દર્શાવેલ સમય મર્યાદામાં આવું કામ કઢાવી નાખવાનો અધિકાર રહેશે. કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે આવું કામ કઢાવવું પડશે. અને તેની જગ્યાએ BAUDA ના એન્જીનીયરની સુચના મુજબ નવા મટીરીયલ્સ થી સારું કામ ફરીથી વિનામુલ્યે કરી આપવાનું રહેશે. જો કોન્ટ્રાક્ટર આવા હુકમનું પાલન કરવાનો અનાદર કરશે. તો BAUDA ના કન્સલ્ટીંગ એન્જીનીયર ટી.પી.આઈ આ કામ દુર કરી નવું કામ કરાવવા માટે બીજા માણસો અથવા સબ કોન્ટ્રાક્ટ આપવાનો અધિકાર રહેશે. આ કામ પાછળ થતો બધો ખર્ચ BAUDA પાસે કોન્ટ્રાક્ટરની જમા પડેલ રકમ, જમા થવાની રકમમાંથી ચુકવી આપશે.

(૨૫) પેમેન્ટ અટકાવવું :-

ધીમી ગતિએ ચાલતું કામ અથવા તો ખરાબ કામગીરી વાળું કામ અથવા તો BAUDA ના કન્સલ્ટીંગ એન્જીનીયરની વખતો વખતની સુચનાઓનું પાલન કોન્ટ્રાક્ટર ન કરે અથવા તો અન્ય કોઈપણ દર્શનિક કારણોને લઈને BAUDA કોન્ટ્રાક્ટરને કરવાનું પેમેન્ટ અટકાવી શકશે અને જ્યાં સુધી BAUDA ને પેમેન્ટ અટકાવવાની જરૂરીયાત માટેના કોઈ કારણ રહ્યાની ખાત્રી થાય ત્યાં સુધી આવું પેમેન્ટ અટકાવી શકશે. આ કોન્ટ્રાક્ટને લગતા કોઈ કામ બાબતે કે કોન્ટ્રાક્ટરે કરવાની કાર્યવાહી થકી કે કરવાનું મોકુફ રાખવાથી કોન્ટ્રાક્ટ વિરુદ્ધ કરેલ દાવો કે પગલા BAUDA ને થતા નુકશાન કે ખોટની જવાબદારી કોન્ટ્રાક્ટની રહેશે અને BAUDA ને આવા દાવા કે કેસમાં રક્ષણ આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.

(૨૬) કોન્ટ્રાક્ટમાં ફેરફાર :-

આ કોન્ટ્રાક્ટની કોઈપણ શરતો કે જોગવાઈઓ ફેરફાર કરવાની જરૂર જણાય તો આવા ફેરફાર લેખિતમાં કરવાની રહેશે એમાં બંને પાર્ટીઓએ સહી કરીને કરવાના રહેશે અને આ ન થાય ફેરફારવાળું કોઈપણ કામ કરવા દેવામાં આવશે નહીં સમગ્ર કોન્ટ્રાક્ટ અથવા તો તેની કોઈપણ શરતો રદ કરતી વધારો કરેલ કે પુરક કોઈપણ જાતનો મૌખિક કે લેખિત હુકમની જવાબદારી જ્યાં સુધી તેમાં BAUDA ની સહી ન થાય ત્યાં સુધી BAUDA ની રહેશે નહીં અને ત્યાં સુધીના આવા હુકમો રદ કરી શકાશે. આવી જ રીતે BAUDA ના એન્જીનીયરને લેખિત ઓર્ડર આપી આ કોન્ટ્રાક્ટ માટેનું કોઈપણ કામ વધારવાનો વિસ્તારવાનો ઓછું કરવાનો તથા ડીઝાઈન, સાઈઝ, જથ્થો, માપ કે મટીરીયલનો ઉપયોગનો ફેરફાર કે બલદવાનો તથા કોઈ વધારાનું કામ લેખિત હુકમથી કરવાનો કે કોઈ ન કરવાનો અધિકાર છે. આવા વધારાના ખર્ચેખર્ચ

થયેલ કામ તથા વપરાયેલ મટીરીયલ્સ પ્રમાણે પેમેન્ટ કરવામાં આવશે. કોઈપણ જાતના વિસ્તરણ સંકોચન વધારો કે ઘટાડો કે ફેરફારને કારણે આ કોન્ટ્રાક્ટની કાયદેસરતાને કોઈ અસર થશે નહીં પરંતુ કોન્ટ્રાક્ટરે આવા કામો કોન્ટ્રાક્ટ માટેના જગણી કોન્ટ્રાક્ટની દરેક શરતો લાગુ પાડીને સ્પેસીફિકેશન મુજબ જ કરવાના રહેશે આવા કામના વિસ્તરણ ઉમેરો સંકોચન ઘટાડો ફેરફાર કે સુધારા વધારાના સમયે BAUDA ના એન્જીનીયરના નિર્ણય મુજબ ટેન્ડરની આઈટમના રેઈટ ઉપરથી નવા રેઈટ નક્કી કરી પેમેન્ટ કરવાનું રહેશે.

(૨૭) કોન્ટ્રાક્ટ ટર્મીનેટ કરવા માટે :-

કોઈપણ સમયે જો BAUDA ના કન્સલ્ટીંગ એન્જીનીયરને એવું જણાશે કે કોન્ટ્રાક્ટરને આપેલ કામ યોગ્ય સમયે શરૂ નથી થયું અથવા તો કોન્ટ્રાક્ટરે લાવેલ માલ મટીરીયલ્સ અથવા તો તેની વર્કમેનશીપ સંતોષકારક નથી તો BAUDA ને આ કોન્ટ્રાક્ટ ૭ – દિવસની લેખિત નોટીસ આપીને ટર્મીનેટ કરવાનો અધિકાર છે અને બાકીનું કામ અન્ય કોન્ટ્રાક્ટર પાસે મુળ કોન્ટ્રાક્ટરના જોખમે અને જવાબદારીઓ પુરુ કરવાનો અધિકાર છે અને બાકીનું કામ અન્ય કોન્ટ્રાક્ટર પાસે મુળ કોન્ટ્રાક્ટરના જોખમે અને જવાબદારીઓ પુરુ કરવાનો અધિકાર છે આવી બાબતોમાં BAUDAના કારણોસર જો BAUDAને કોન્ટ્રાક્ટમાં દર્શાવેલ સમગ્રકામ અથવા તો તેનો કોઈભાગ કરવાની જરૂર ન લાગે કે ઈચ્છા ન થાય તો BAUDA કોન્ટ્રાક્ટરને લેખિત નોટીસ આપીને કામ બંધ કરાવી શકશે જો BAUDA ધ્વારા કોન્ટ્રાક્ટ ટર્મીનેટ કરવામાં આવે અથવા તો સમગ્ર કામ કે તેનો કોઈભાગ કેન્સલ કરવામાં આવેતો કોન્ટ્રાક્ટને સમગ્ર કામ પૂર્ણ થયે થવો જોઈતો નફો કે લાભ કે આવુ કામ ન કરવાથી ન થયુ તે બાબતનું કોઈપણ જાતનું વળતર કે ચુકવણું આપવામાં આવશે નહીં આમ છતાં તે કોન્ટ્રાક્ટરે કરેલા ખરેખર કામના માપ મુજબ નક્કી કરેલ ભાવ પ્રમાણેનું પેમેન્ટ કરી આપવામાં આવશે.

કોન્ટ્રાક્ટરની સહી

(નામ :.....)

કરારનામું (કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ)

લખાવી લેનાર :

લખી આપનાર

ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી,

ભરૂચ

કામનું નામ :-.....

આથી હું શ્રી..... તે..... ના માલિક ધંધો કોન્ટ્રાક્ટર, ઉ.વ..... તથા જ્ઞાતી..... રહે. આથી લખી આપી બંધાઉ છું કે આપના તરફથી ઉપરોક્ત કામ અંગે જાહેર ટેન્ડર નોટીસથી ઓનલાઈન પર્સનલ રેઈટ ટેન્ડર મંગાવવામાં આવેલ (તા..... ના રોજ કલાક સુધી મા) તે પૈકી અમારુ તા. નુ ઉપરોક્ત કામ ના ભાવો નુ ટેન્ડર ફુલ રૂપિયા (અંકે રૂપિયા પુરા) નુ મંજૂર કરવામા આવેલ છે જે અન્વયે રૂપિયા ના નોન જ્યુડિશીયલ સ્ટેમ્પ પેપર્સ ઉપર નીચે મુજબ નુ કરારનામુ કોન્ટ્રાક્ટ એક્ટ ૧૮૭૨ એમેન્ડેડ એસ ટુ ડે (આજ દિવસ ના સુધારા વધારા સહિત) ભરુચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી ભરુચ સાથે કરી આપુ છું.

શરતો

- ૧) સંપૂર્ણ કામગીરી એજન્સી દ્વારા થતી હોવાથી કામગીરી દરમ્યાન તથા ડીફેક્ટ લાયબીલીટી દરમ્યાન જો અન્ય કોઈ વ્યક્તિ ને કે કોઈ જીવ ને શોર્ટ સર્કિટ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે જેમાં BAUDA ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં.
- (૨) કામની સમય મર્યાદા ૦૩ (Three Month) માસની છે. આ સમય મર્યાદા કામ કરવાનો હુકમ મળ્યાની તારીખથી ગણવામાં આવશે.
- (૩) કામના થતા બિલમાંથી પ્રવર્તમાન દર મુજબ ઈન્કમ ટેક્સ તેમજ ૧% મુજબ વેલ્ફર ફંડ, ૧% ટેસ્ટીંગ ચાર્જ કપાત કરવામાં આવશે તેમજ સિક્યોરીટી ડીપોઝીટ એજન્સીના ભાવ મંજૂર થયેથી ૫.૦૦% મુજબ અને બિલમાંથી ૫.૦૦ % મુજબ કપાત કરવામાં આવશે. આમ કુલ સિક્યોરીટી ડિપોઝીટ ૧૦.૦૦% મુજબ છે.
- ૪) આ કામમાં વાપરવામાં આવતા તમામ માલસામાન ઉપર રોયલ્ટી સેલટેક્સ તેમજ અન્ય જે કાંઈ સરકારી લેણા થશે તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની (એજન્સીની) રહેશે.
- (૫) આ કામમાં વાપરવાનું તમામ મટીરીયલ્સ પી.ડબલ્યુ.ડી. હેન્ડ બુક વોલ્યુમ નં.૧ અને ૨ તથા ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ રહેશે તથા ટેન્ડરમાં આપેલ સ્પેશીફિકેશન તેમજ BAUDA ના એન્જીનીયરની લેખિત સુચના મુજબ કરવાની રહેશે.

- (૬) મંજૂર થયેલા ભાવો ઉપર કોઈપણ સંજોગોમાં ભાવ વધારો (પ્રાઈઝ એક્સકેલેશન) આપવામાં આવશે નહીં.
- (૭) આ કામમાં વાપરવાન જે માલ-સામાન અમો બહારથી લાવીએ તેની ધોરણસરની રોયલ્ટી અમારે ભરપાઈ કરીને ત્યારબાદ તે માલસામાન સાઈટ ઉપર લાવવાનો રહેશે.
- (૮) આ કામમાં વાપરવામાં આવતા તમામ માલસામાન ઉપર રોયલ્ટી સેલટેક્સ તેમજ અન્ય જે કાંઈ સરકારી લેણા થશે તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની (એજન્સીની) રહેશે.
- (૯) સદર કામ મા આર.સી.સી ભરાઇ મિક્સ ડિઝાઇન પ્રમાણે કરી આપવાની રહેશે તેમજ આર.સી.સી ભરાઇ મા વાઇબ્રેટર વાપરવાનુ રહેશે.
- (૧૦) તમામ માલ-સામાન એન્જીનીયર BAUDA પાસેથી અગાઉ થી પાસ કરાવ્યા બાદ જ સાઈટ ઉપર સપ્લાઈ કરવાનો છે. તેમ છતા જો સપ્લાય કરેલ મટીરીયલ્સ એન્જીનીયર BAUDA ને ટેકનીકલી અનસાઉન્ડ લાગશે તો તે કોન્ટ્રાક્ટ ખર્ચે અને જોખમે સાઈટ ઉપરથી ખસેડી લેવાનું રહેશે અને કોન્ટ્રાક્ટ એમ કરવામાં નિષ્ફળ જશે તો BAUDA કોન્ટ્રાક્ટર ના ખર્ચે અને જોખમે તે મટીરીયલ્સ સાઈટ ઉપરથી ઉપાડી લેશે.
- (૧૧) આ કામમાં જે વધારાની એક્સ્ટ્રા આઈટમનું કામ કરવાનું થાય તે ચાલુ એસ.ઓ.આર. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ – ભરૂચ તથા માર્ગ અને મકાન વિભાગ - ભરૂચ ના શેડ્યુલ ઓફ રેઈટસના ભાવથી કોન્ટ્રાક્ટરે કરી આપવાનું છે અથવા રેટ એનાલીસીસ મુજબ કરી આપવાનું છે.
- (૧૩) સંપૂર્ણ કાર્ય સંસ્થાના BAUDA ના માર્ગદર્શન અનુસાર કરવાનું છે.
- (૧૪) સઘળા કામની વર્કમેન શીપ પબ્લીક વર્કસ ડીપાર્ટમેન્ટ હેન્ડબુલ વોલ્યુમ ૧ તથા ૨ ની સને ૧૯૪૯ ની ૬ આવૃત્તિમાં આપેલ સ્પેસીફિકેશન મુજબ કરી આપવાનું રહેશે.
- (૧૫) આ કામ સમય મર્યાદામાં પુરુ ન થાય તો ટેન્ડરમાં જણાવ્યા અનુસાર પેનલ્ટી BAUDA વસુલ કરી શકશે.
- (૧૬) સદરહું કામ અંગેનો સઘળો પત્રવ્યવહાર BAUDA ના નામે કરવાનો રહેશે.
- (૧૭) રાત્રીના કામ કરવાનું હોય તો BAUDA ની પુર્વ મંજૂરીથી તે ચાલુ રાખી શકાશે.
- (૧૮) કામની સિક્યોરીટી ખાતર દર્શાવેલ મુદતમાં કરેલ કામમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ આવશે તો તે જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.
- (૧૯) આ કામે અમોએ ભરેલ ટેન્ડર શિડ્યુલ બી, એસ.બી.ડી. તથા સ્પેશીફિકેશન તથા અન્ય સાધનીક કાગળો એગ્રીમેન્ટનો ભાગ ગણાશે.

- (૨૦) સદરહું કામમાં ફાઈનલ બિલ બનાવતા પહેલા જરૂરી રોયલ્ટી માટે ખાણ ખનીજ વિભાગનું ના વાંધા પ્રમાણપત્ર, સિમેન્ટના પાકા બિલો, તેમજ માલ-સામાન, અને ક્યુબ ટેસ્ટીંગ માટેના એજન્સીએ જે ગર્વમેન્ટ માન્ય લેબોરેટરીમાં પરીક્ષણ કરાવેલ હોય તે લેબોરેટરીને ફી ચુકવેલ હોય તે ફી ના બિલ ૧% મુજબ ટેન્ડરની અંદાજીત રકમના રજુ કરવાના રહેશે.
- (૨૧) જરૂર જણાયે પ્લાન એસ્ટીમેઈટ વિગેરેમાં ફેરફાર કરવાની સત્તા chief Executive Authority BAUDA ની રહેશે.
- (૨૨) મંજૂર થયેલ જથ્થા કરતા કામ ઓછુ કે વધારે કરાવવું તે BAUDA ની મનસુફી ઉપર છે અને એસ્ટીમેઈટ કરતા વધારે કામ BAUDA તરફથી આપવામાં આવે તો તે તમારે અમારા મંજૂર થયેલ ભાવથી કોઈપણ આઈટમનું કામ તેમજ સઘળી આઈટમનું કામ, કરી આપવાનું છે.
- (૨૩) પાવર, પાણી કે રોડ રોલર દીવાબતી ઈત્યાદીની સગવડ અમારે કરવાની રહેશે પરંતુ યોગ્ય બંદોબસ્ત BAUDA તરફ થી કરી શકાય તેમ હશે તો BAUDA ને જરૂરી ફી ભરી આપીશું.
- (૨૪) આ કામ ઉપર અમારે સત્તાધીશ ટેકનીકલ જ્ઞાન ધરાવતો પ્રતિનિધી રાખવાનો છે, કે જે કામ ઉપર દેખરેખ રાખી (સ્કીલ્ડ તેમજ અનસ્કીલ્ડ) મજૂરો ઉપર કાબુ રાખી શકે જે તે અધિકૃત અધિકારી તરફથી વખતો વખત સુચના મુજબની કામગીરી સંપૂર્ણ રીતે કરાવી શકે.
- (૨૫) સયોટ કારણોસર કામ સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય તો વ્યાજબી કારણોસર સમયમર્યાદામાં કોન્ટ્રાક્ટરની અરજી અન્વયે વધારી આપવાની સત્તા chief executive authority BAUDA ની રહેશે.
- (૨૬) કામ પુરુ થયે સફાઈ ચોકસાઈ ઈત્યાદીની બિન જરૂરી વેસ્ટ સાફસુફી કરી આપવાની રહેશે જેનો કોઈખર્ચ કોન્ટ્રાક્ટરને BAUDA તરફથી આપવામાં આવશે નહીં.
- (૨૭) શ્રી પ્રોજેક્ટ કન્સલ્ટન્ટે માપ લીધેલ હશે તે રેકૉર્ડ મુજબના માપો અમારે માન્ય રાખવાના રહેશે માપ લેતી વખતે અમારે BAUDA ના કન્સલ્ટન્ટ એન્જીનીયર સાથે હાજર રહેવાનું રહેશે.
- (૨૮) આ કામ દરમ્યાન કોઈપણ જાનમાલની હાની થાય કે કોઈપણ જાતના અકસ્માત થાય તો તે અંગેની વર્કમેન કમ્પેશન એક્ટ અન્વયે જે કોઈ જવાબદારી ઉભી થાય તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની છે.
- (૨૯) ફક્ત મટીરીયલનું કોઈ એડવાન્સ પેમેન્ટ આપવામાં આવશે નહીં તેમજ બજાર કિંમતમાં થતા વધારા મુજબ કોઈ ભાવ વધારો માલ સામાનમાં મંજૂરી કામમાં આપવામાં આવશે નહીં.
- (૩૦) જો હું આ કામમાં ઢીલ કરૂ તો BAUDA આ કામ મારા ખર્ચે અને જોખમે બીજા કોન્ટ્રાક્ટર પાસે કરાવી લેવા મુખત્યાર રહેશે. તેમાં જે નુકશાની જાય તે મારે ભરવાની છે અને નફો થાય તો તેના ઉપર મારો કોઈ હકક રહેશે નહીં.
- (૩૧) કુદરતી રીતે કોઈપણ નુકશાન થાય તો તેની જવાબદારી કોન્ટ્રાક્ટરના શીરે રહેશે.

- (૩૨) કોન્ટ્રાક્ટરે પોતે રાખેલ કારીગરો મજૂરોને મીનીમમ વેઈઝીસ ઓર્ડર પ્રમાણે મજૂરીના દર આપવાના રહેશે.
- (૩૩) આકામ વ્યવસ્થિત સ્પેશીફીકેશન મુજબ નહીં કરવામાં આવે તો તે અંગેના તમામ ખર્ચની જવાબદારી કોન્ટ્રાક્ટરના શીરે રહેશે અને તે માટે કોન્ટ્રાક્ટ રદ થવાને પાત્ર રહેશે અને બાકીનું કામ કોન્ટ્રાક્ટરના ખર્ચે અને જોખમે કરાવી લેવા BAUDA મુખત્યાર છે. આવા સંજોગોમાં ડિપોઝીટની રકમ જમ કરવા તથા થયેલ કામમાંથી થયેલ તમામ ખર્ચ વસુલ લેવા BAUDA મુખત્યાર છે.
- (૩૪) વર્ક ઓર્ડર મુજબ આપેલ કામમાં ચાલુ કામો અન્ય આસામીઓની મિલકત અગર જાનમાલની કોઈપણ નુકશાન થશે તો તેની જવાબદારી કોન્ટ્રાક્ટરના શીરે રહેશે અને તે અંગે કોઈપણ વળતરની રકમ ચુકવવાની થાય તો તે કોન્ટ્રાક્ટરે ચુકવી આપવાની રહેશે. જો કોન્ટ્રાક્ટર વળતર ચુકવવાનો અમલ ન કરે તો તેવા વળતર વગેરેની રકમ તેના બિલમાંથી કાપી લેવામાં આવશે.
- (૩૫) આ કામ કરતા કોઈપણ મજૂર, કારીગર, સુપરવાઈઝર કે અન્ય વ્યક્તિને ઈજા થાય અથવા તો મૃત્યુ માપે તો તેબની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.
- (૩૬) ખોદાણકામ દરમ્યાન ટેલીફોનના કેબલ કે કોઈ અન્ય સર્વિસ લાઈનમાં પાઈપ લાઈન કે અન્ય કોઈપણ ઈસમોની નુકશાની ઈજારદારે સ્વખર્ચે ભોગવવાની રહેશે.
- (૩૭) ટેન્ડરમા સામેલ કરેલ ચુકવણા તથા કામ બાબતની ખાસ શરતો તેમજ આ ટેન્ડર કરારનો એક ભાગ ગણાશે જે કોન્ટ્રાક્ટર અથવા તેના ભાગીદાર અને તેના વારસોને માન્ય રહેશે. આ કરારનામુ રૂપિયા..... નો નોન જયુડીશીયલ સ્ટેમ્પ પેપર્સ જેની તારીખ.....જેના પહેલા સ્ટેમ્પના રજી. ના નં.....થી.....સ્ટેમ્પ ૧ થી..... તથા કોરા લેઝર પાના,..... ઉપર ટાઈપ કરાવી આપેલ છે.

ઉપર મુજબનુ કરારનામું મેં પોતે વાંચી સમજી અકકલ હોંશીયારીથી વિના કેફે કોઈની શેહ શરમ રાખ્યા વગર રાજીખુશીથી કરી આપેલ છે. જે મને તથા મારા બધા ભાગીદારો તથા મારા વાલી, વંશ, વારસો ને દરેક પ્રકારે કબુલ મંજૂર તેમજ બંદનકર્તા છે જે બદલ મે મારી સહી કરી જરૂરી શાખો નીચે કરાવેલ છે.

સ્થળ :

.....

તી.....

(કોન્ટ્રાક્ટરની સહી)

શાખો:- (નામ તથા સરનામું)

(૧)

.....

.....

ભરુચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી
ભરુચ

(૨).....

ભરુચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી
ભરુચ

.....

.....

Special Conditions

Tenderer shall very carefully read through and take note of following conditions.

1. The successful tenderer shall have to enter into an agreement in form. Tender can be inspected during office working hours and shall be part of agreement with successful tenderer.
2. The tenderer shall get himself well acquainted with the job requirement site conditions, route and alignment etc.
3. Contractor shall make his own arrangement for providing all necessary tools, plants, equipment's, manpower as required. No extra payment in any such respect would be made to the contractor.
4. Contractor shall while entering into agreement shall produce the registration certificate of his establishment with the competent authority of R.P.F.C. failing which 3% (Three percentage) of the bill value due to be paid to contractor shall be deducted at source and shall be refunded only against production of such certificate.
5. In conformity with prevailing income tax Rules 2% and surcharges of bill value shall be deducted at source as per I.T. Rules for which necessary certificate shall be released by the Chief Officer.
6. Labor welfare Cess from each R.A. Bill shall be recovered at the rate of 1% of the tendered amount, as per relevant Agreement.
7. Staff of contractor should cover under suitable insurance scheme. The tenderer has to take site visit and understand the work before submitting the tender.
8. The contractor shall be responsible for theft of the materials etc.
9. The medical facilities, weekly off, safety equipment's, over time etc. as per Government Act, will be provided by the agency to the staff engaged for the job.
10. In case of accident during the work, all the responsibility of man, machinery & property will be rest with the agency.
11. The contractor shall provide for due replacement of persons in case the regular staff remains away from the duty for which "NO EXTRA COST " may be claimed.
12. The payment shall be made as per actual work done.
13. Machinery, materials, labours etc. are to be brought by agency at his own expenditure.

Instruction for online tender to Bidders

- 1) The tender notice can be seen from the **web site of www.nprocure.com**.
The tender documents can be downloaded from the **web site www.nprocure.com** and should be up- loaded in prescribed time limit.
- 2) EMD & Tender fee shall be submitted for verification as mentioned in tender notice / memorandum of work.0
- 3) The Successful tenderer has to enter into agreement with Chief Executive authority and the same can be seen from the concerned office of Chief Executive authority during office hours on all working days.
- 4) EMD:
 - Earnest money shall be paid in the form or demand draft or FDR from any scheduled / nationalized bank. Earnest Money in cash or cheque or bank guarantee shall not be accepted. EMD should be valid for minimum period of 120 days. The EMD should be drawn in favour of the **“CEA, BAUDA Bharuch”**, Units registered with Industries Dept. or with NSIC as a Small Scale Unit shall have also to pay prescribed tender fees and earnest money deposit. Exemption certificate issued by Govt. / any other authority for EMD shall not be valid for **“CEA, BAUDA Bharuch”** works.
 - The amount of earnest money deposit to be paid in the form of DD / FDR in favor of **“CEA, BAUDA Bharuch”** should be attached, along with the tender only; otherwise it will not be accepted. It may be noted that DD / FDR brought personally at the time of opening, will not be accepted at all.
 - The earnest money deposit of the unsuccessful contractor(s) shall be returned without interest within reasonable time after final decision on the tenders and after entering into a contract with the Corporation by the contractor whose tender is accepted.
- 5) The contractor shall have to furnish Income Tax Clearance certificate before his tender is accepted and intimate assessment number and ward under which is accessed.

CONTRACTORS TO PLEASE READ THIS CAREFULLY

- 1) Earnest money as mentioned in the Memorandum of work in brief attached herewith shall be paid in the form of D.D./F.D.R for the minimum period of 120 days and document for the same should be attached with this Technical bid with pre- qualification only.
- 2) The contractor shall also apply for qualification in the manner set out in the Technical bid with qualification application.
- 3) For this contract, the defect liability period is Three years from the actual date of completion of the works.
- 4) The rates for items in Schedule "B" attached with the Price Bid must be given in words and figures.
- 5) If the tender is taken in favour of the company, a power of attorney / necessary authorization in favour of the person who may have signed the tender for the company, must accompany the tender.
- 6) All the work shall be carried out as per the specifications attached with this Technical bid with application.
- 7) The rate quoted include clearance of site (Prior to commment of work at its close) in all respects and hold good for work under all conditions including site moisture, weather. etc.
- 8) Please also read the chapter – I & II of SBD attached with the technical Bid.
- 9) All the columns in Schedule "B" attached with the price bid should be filled in ink and the total entries in the last column should be struck by the contractor under his signature.
- 10) All pages of Schedule "B", attached with the Price bid & Schedule "B" attached with this Technical bid with prequalification application should be initialed by the contractor.
- 11) The contractor shall have to furnish the Permanent Account No., Assessment No. & Ward under which he is assessed.
- 12) Percentage Rates specified to be executed as per Schedule "B" in the price bid are inclusive of all labour, materials, testing charges, equipment's, all incidental charges involved in the items and as specified in the mode of

measurement & payment of detailed specifications of items, incl. all taxes, royalty, octroi, transportation cost etc. all as applicable presently and as to be enforced for future by any / all including Central/State Govt. and Statutory bodies from time to time.

- 13) The contractor shall have to furnish the True copy of the Sales Tax Registration & R.P.F.C. registration certificate and registration of "D" class & Above and bank solvency certificate of current year.
- 14) As per Govt. Notification rules 1998, construction workers welfare cess shall be recovered as per Govt. circular from R.A. Bill (copy of Govt. circular is a part of tender document).
- 15) Royalty shall be deducted from the R.A. Bill as per prevailing Govt. Circular / G.R. / Notification.